

મંજૂરી પત્ર

તારીખ:

ગ્રાહકનું નામ-

સરનામું-

પ્રિય સર/મેમ,

કૃપા કરીને વ્હિઝડમ ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ તરફથી લોન/ક્રેડિટ સુવિધા માટે તમારી નાણાકીય સહાયની અરજી # _____ જુઓ. તમને એ જણાવતાં અમને આનંદ થાય છે કે અમે "મનીવ્યુ" મારફતે કરવામાં આવેલી તમારી અરજી સામે ₹ _____/- ની રકમ મંજૂર કરી છે. નાણાકીય સહાયનું સંચાલન કરતી વ્યાપક શરતો નીચે મુજબ છે.

01.	લોનની રકમ	₹
02.	વ્યાજનો દર % પ્રતિ વર્ષ (વાર્ષિક)	
03.	કાર્યકાળ (મહિનાઓ)	
04.	હેતુ	
05.	પ્રોસેસિંગ ફી	₹
06.	વિતરણની રકમ	ગ્રાહકને ટ્રાન્સફરેબલ રકમ* - ₹ /-
07.	બાકી રહેલો / દંડાત્મક શૂલ્ક	દૈનિક ધોરણે ગણતરી કરવામાં આવેલી બાકી નીકળતી રકમ પર 24% પ્રતિ વર્ષ વત્તા લાગુ પડતા કરવેરા (જો કોઈ હોય તો)
08.	લોક-ઇન સમયગાળો	18 મહિના સુધીની લોનની મુદત માટે 6 મહિનાનું લોક-ઇન, 18 મહિનાથી વધુ લોનની મુદત માટે 12 મહિનાનું લોક-ઇન
09.	બાઉન્સ ચાર્જીસ	₹ 500 બાકી ઇએમઆઈની રકમમાં દરેક બાઉન્સ પેમેન્ટ પર ઉમેરવામાં આવશે. આ તમારી બેંક દ્વારા વસૂલવામાં આવતા બાઉન્સ ચાર્જ ઉપરાંત છે
10.	ઇએમઆઈ ની રકમ	₹
11.	ઇએમઆઈ ની તારીખ	

*વીમા પ્રીમિયમ ચાર્જીસને કારણે ગ્રાહકને ટ્રાન્સફર કરી શકાય તેવી રકમમાં ઘટાડો થઈ શકે છે, જે વિતરણની તારીખને આધારે હોઈ શકે છે.

નિયમો અને શરતો:

- ગ્રાહક જાહેર કરે છે કે તે/તેણી અંગ્રેજી ભાષા સમજે છે અને આ મંજૂરી પત્રની શરતો સ્પષ્ટપણે સમજી લીધી છે.
- આ ઓફર ઇશ્યૂની તારીખથી ૩૦ કાર્યકારી દિવસો સુધી માન્ય છે. આ લોનને લાગુ પડતા ચાર્જીસ અને કપાતનો ઉલ્લેખ અરજી પત્ર અને મંજૂરી પત્રમાં કરવામાં આવ્યો છે.

દરેક ગ્રાહક માટે જોખમોના ગ્રેડેશનનું મૂલ્યાંકન કરવા માટે ધ્યાનમાં લેવાયેલા અભિગમ/પરિબળો આ મુજબ છે:

- a) પ્રોફાઇલ, નાણાકીય સ્થિરતા અને બજારની પ્રતિષ્ઠા.
- b) ક્રેડિટ ઇતિહાસ અને સંબંધનો સમયગાળો.
- c) એકંદરે ગ્રાહકોની ઉપજ, ભવિષ્યની સંભવિતતા, રોકડ પ્રવાહ અને અન્ય નાણાકીય પ્રતિબદ્ધતાઓ પર આધારિત પુનઃચુકવણીની ક્ષમતા.
- d) સંબંધિત ગ્રાહક સેગમેન્ટમાં વ્યાજ, ડિફોલ્ટ જોખમ.
- e) આરબીઆઈની માર્ગદર્શિકા, અન્ય કાયદાઓ અથવા કેસ-થી-કેસ ના આધારે અન્ય કોઈ પરિબળો લાગુ પડે છે.
- f) અન્ય (જો કોઈ હોય તો)

વ્યાજના દરની ગણતરી માટે ધ્યાનમાં લેવામાં આવેલા પરિબળોને કંપનીની વ્યાજ દર નીતિમાં વધુ વિસ્તૃત રીતે વર્ણવવામાં આવ્યા છે, જે અહીં - <https://whizdmfinance.com/interest-rate-policy> એક્સેસ કરી શકાય છે

વિતરણનો કાર્યક્રમ, વ્યાજના દર, સર્વિસ ચાર્જિસ, પ્રિપેમેન્ટ ચાર્જિસ વગેરે સહિતના નિયમો અને શરતોમાં કોઈ પણ ફેરફારની જાણ સમયાંતરે ઋણલેનારને ઇમેઇલ દ્વારા કરવામાં આવશે અને તે માત્ર અસરકારક રીતે જ થશે.

એસએમએ અને એનપીએના વર્ગીકરણનું ઉદાહરણ નીચેની લિંક પર મેળવી શકાય
<https://whizdmfinance.com/customer-education-literature>

વિહઝડમ ફાઇનાન્સ પ્રા.લિ.

આ સિસ્ટમ દ્વારા જનરેટ કરેલો પત્ર છે અને તેમાં કોઈ સહીની જરૂર નથી.